



# Children's University

(Established by the Government of Gujarat)

Shubhashchandra Bose Sixan Sankul, Sector: 20, Gandhinagar. Phone: 079-23244576, 23244569.

Email Id: [vccu.gujarat@gmail.com](mailto:vccu.gujarat@gmail.com). Official Website Address: [www.cugujarat.ac.in](http://www.cugujarat.ac.in)

## Center of Education

એમ.એસસી. (M.Sc. Foods & Nutrition) પ્રવેશ – ૨૦૧૮-૧૯ માહિતી અને સૂચનાઓ

M.Sc.- Foods & Nutrition		
Online ફોર્મ ભરવાની છેલ્લી તારીખ	૨૦/૦૬/૨૦૧૮	રાત્રે ૧૧.૪૫ સુધી
અરજી પત્રક (પ્રિન્ટ) મોકલવાની છેલ્લી તારીખ	૨૩/૦૬/૨૦૧૮	સાંજે ૫.૩૦ કલાક સુધી

### સૂચનાઓ –

- યુનિવર્સિટી પ્રવેશ જાહેરાત ક્રમાંક ૧૧ [એમ.એસસી- (Foods & Nutrition)] માં દર્શાવ્યા પ્રમાણેના વિષયમાં સ્નાતક કક્ષાએ ઓછામાં ઓછા ૪૫ ટકા ગુણ અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના અને ઓબીસી ઉમેદવારો માટે ૪૦ ટકા ગુણ હોવા જરૂરી છે.
- સ્નાતકના અંતિમ સત્ર/વર્ષનું પરિણામ બાકી હશે તે ઉમેદવારો પણ અરજી કરવા માટે પાત્ર બનશે પરંતુ અંતિમ સત્ર/ વર્ષનું પરિણામપત્ર પ્રવેશની અંતિમ તારીખ પહેલા જમા કરાવવાનું રહેશે. જેમાં ક્રમાંક ૧ મુજબની પાત્રતા પૂર્ણ કરવાની રહેશે.
- પ્રવેશ મેળવ્યા પછી પણ કોઈપણ તબક્કે શૈક્ષણિક લાયકાત કે અન્ય માહિતી અધૂરી કે ખોટી રજૂ કરેલી જણાશે તો પ્રવેશ રદ કરવામાં આવશે.
- ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના પ્રવર્તમાન અનામતના ધોરણો અનુસાર પ્રવેશ આપવામાં આવશે.
- ઉમેદવારે પ્રવેશપ્રક્રિયા દરમિયાન સ્વખર્ચે આવવાનું રહેશે.
- ઉમેદવારે અરજી online કરવાની રહેશે. અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ આઉટની કોપી, પ્રમાણિત નકલો સાથે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે રૂબરૂ/પોસ્ટ/ કુરિયર દ્વારા તારીખ ૨૩/૦૬/૨૦૧૮ સાંજે ૫.૩૦ કલાક સુધીમાં પહોંચાડવાનું રહેશે(બીજો અને ચોથો શનિવાર, રવિવાર તેમજ જાહેર રજાના દિવસો સિવાય). ત્યારબાદ મળેલ અરજી કોઈપણ સંજોગોમાં ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
- ફી અને ફોર્મ ભરવાની વિગત માટે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની વેબસાઈટ [www.cugujarat.ac.in](http://www.cugujarat.ac.in) પરની સૂચનાઓનું પાલન કરવું.
- શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૨૦૧૯ માટેની પ્રવેશ પ્રક્રિયા ફી ૫૦૦/- છે જે કોઈપણ સંજોગોમાં પરત મળવાપાત્ર નથી.
- પસંદગી પામેલ ઉમેદવાર જો અંતિમ તારીખ સુધીમાં ફી જમા નહીં કરાવે તો પ્રતિક્ષા યાદીમાં રહેલા ઉમેદવારને અગ્રતાક્રમ અનુસાર પ્રવેશ આપવામાં આવશે. ફી ભરવાની તારીખ પ્રવેશયાદી વેબસાઈટ પર પ્રસિદ્ધ થાય તેની સાથે જણાવવામાં આવશે.
- પ્રવેશ સ્નાતક કક્ષાએ મેળવેલ કુલ ગુણના આધારે પ્રવેશ યાદી જાહેર કરવામાં આવશે.
- ઉમેદવારે અરજીપત્ર સાથે ફોર્મમાં જણાવેલ બધી જ શૈક્ષણિક લાયકાતોના પ્રમાણપત્રો જોડવાનાં રહેશે. ઉપરાંત નીચેનામાંથી લાગુ પડતા પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલો જોડવાની રહેશે.
  - શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  - એસ.સી./એસ.ટી.ના ઉમેદવારોએ જાતિનું પ્રમાણપત્ર અવશ્ય જોડવું.
  - ઓ.બી.સી.નાં ઉમેદવારોએ તેમનું તાજેતરનું માન્ય નોનકિમિલેયર પ્રમાણપત્ર જોડવું.
  - શારીરિક અપંગતા ધરાવતા ઉમેદવારોએ તેમનું વિકલાંગતાનું પ્રમાણપત્ર જોડવું.

■